

604, 6th Floor, Zion Z1, Nr. Avalon Hotel, Sindhu Bhavan Road, Bodakdev, Ahmedabad-380054

Date: - 26th August, 2025

Phone: 079 - 4917 2660 E-mail: rachanainfra404@gmail.com / info@rachanainfra.com CIN No.: L45203GJ2001PLC039725 Website: www.rachanainfra.com

To. The Manager **Listing Department National Stock Exchange of India Limited** Exchange Plaza, Bandra-Kurla Complex Bandra (E), Mumbai-400051, Maharashtra, INDIA

Scrip Code: RILINFRA

Sub: Newspaper Advertisement - Notice to the Members of the Company Regarding 24th Annual General Meeting to be held through VC/OAVM under Regulation 30 And Regulation 47 of The SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

Dear Sir/Ma'am,

Pursuant to Regulation 30 and 47 of the Securities and Exchange Board of India (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015, we are submitting herewith the copies of newspaper publication, with respect to the notice of 24th Annual General Meeting to be held on Monday 22nd September, 2025 in Ahmedabad edition of ""FINANCIAL EXPRESS" (English and Gujarati) on 25th August, 2025.

We request you to take note of the same and update record of the Company accordingly.

Thanking you, Yours faithfully, FOR, RACHANA INFRASTRUCTURE LIMITED



Himali M. Thakkar **Company Secretary & Compliance Officer Membership No: A47962**

Encl: As Above

FINANCIAL EXPRESS

7th SALE NOTICE Registered Office: 23-16-44, Jaigopal Bhavan Haripuram, Rajahmundry, East Godavari, Andhra Pradesh, PIN 533105 IN Liquidator's Address: House No. 1-1-380/38, Ashok Nagar Extension, Hyderabad - 500020.Contact: + 91 9849995678; E-mail: rp.karuturiceramics@gmail.com , bnagabhushan@yahoo.com

E-AUCTION

UNDER INSOLVENCY & BANKRUPTCY CODE, 2016 The following Assets and Properties of M/s. Karuturi Ceramics Private Limited (in Liquidation) having CIN U26933AP2010PTC117739 forming part of Liquidation Estate are for sale by the Liquidator through e-auction on "AS IS WHERE IS," "AS IS WHAT IS" and "WHATEVER THERE I BASIS" AND "NO RECOURSE BASIS" as per details mentioned in the table below: The Sale wi be done through the E-Auction platform (With unlimited extension of 5 mins each https://ibbi.baanknet.com/eauction-ibbi/home

Reserve Price EMD Amount Bid Incremental Asset Description in Rs Value (in Rs.) In Rs. Sale of Plant and Machinery of the Company 4,95,49,220/-49,54,922/-5 Lakhs

09.09.2025

(Sale of assets on Standalone basis) Last Date for Submission of Eligibility Documents 07.09.2025 Last Date for Inspection with two days prior intimation to Liquidator 07.09.2025

Last date for EMD

11.00 A.M to 04.00 P.M of 12.09.2025 E-Auction Date and Time 1. Prospective bidders shall submit the requisite documents, including a declaration of eligibility under Section 29A of the Insolvency and Bankruptcy Code through the electronic auction

Interested applicants may register themselves at https://ibbi.baanknet.com/eauction-ibbi/home. to download the COMPLETE E- AUCTION PROCESS INFORMATION DOCUMENT containing details of terms and conditions of online E-Auction portal. E-Auction Bid form Eligibility Criteria, Declaration by Bidders, EMD requirement etc. Interested bidders shall upload their eligibility documents as prescribed in the E-AUCTION PROCESS INFORMATION DOCUMENT. The requisition of additional information, if any, be sent to E-Mail id: rp.karuturiceramics@gmail.com(process specific).

B.Prospective bidders shall deposit the Earnest Money Deposit (EMD) through the https://ibbi.baanknet.com/eauction-ibbi/home website.

4. The Earnest Money Deposit (EMD) of the Highest Bidder shall be forfeited if found ineligible subsequent to the auction process.

5.It is to be noted that the bidders cannot place a bid for the value below the reserve price and incremental amount for company

6. The Liquidator has right to accept or cancel or extend or modify etc., any terms and conditions of E- Auction at any time. The Liquidator has a right to reject any of the bid without giving any reasons and/or can cancel the E-Auction at any time.

.E-Auction platform: Interested bidders are requested to visit the https://ibbi.baanknet.com/eauction-ibbi/home website and submit a bid and upload the

B.GST & other levies, taxes shall be levied if any, will be payable extra in addition to the Reserve Price/final sale price etc. by the bidder. Naga Bhushan Bhagawati

Liquidator M/s. Karuturi Ceramics Private Limited Date: 25-08-2025 Place: Hyderabad IBBI Reg. No.: IBBI/IPA-001/IP-P00032/2016-17/10085



Rule 8(5)(d) r/w R 9(1) proviso of SECURITY INTEREST (ENFORCEMENT) RULES,2022

This is to inform the M/s Shree

Rajendra Mobile Point (Borrower),

M/s Dhyandev Enterprise Pvt. Ltd.

(Co-Borrower) , Mr. Shrenik Kirtilal

Sheth (Co-Borrower), Mrs. Jyotiben

Shrenik Sheth (Co-Borrower)

(GJAGAH01319), and General Public

that M/s. Hinduja Leyland Finance

Ltd intends to effect sale of the

Schedule Mentioned property which is

under the possession of M/s. Hinduja

Leyland Finance Ltd on AS IS WHERE

IS / AS WHAT IS BASIS by PRIVATE

TREATY UNDER THE SARFAESI ACT

under Sub Rule 5(d) of Rule 8 of

In case the successful bidder fails to

pay the balance amount of the Sale

consideration within 15 days after the

intimation that the sale has been

knocked down in his favor, the entire

deposit of EMD made by him/her shall

be forfeited by the Authorized Officer

M/s. Hinduja Leyland Finance Ltd has

received an offer for Rs. 1,75,00,000/-

Rupees One Crores Seventy-Five

Lakhs only) for the Schedule

mentioned Property (ies), The Said

OFFER would be confirmed and Sale

would be effected if no Higher Bid is a

are received Sale would be effected IF

NO HIGHER BID / BIDS ARE RECEIVED

WITHIN 15 DAYS OF THIS PUBLIC

Description of the Immovable

Property: SCHEDULE OF THE

PROPERTY All that piece and parcel of

immovable property bearing OFFICE

NO. 405 & 406, (Level-1, Level-2 &

Level-3) on 4th Floor, admeasuring

9000 Sq. Fts. In Scheme Known as

SHITAL VARSHA-5 Situated at land

bearing Survey No. 170 Paiki (Old

Survey No. 265 Paiki of Vejalpur) Final

Plot No. 55 of TPS- 5 of Mouje

JODHPUR, Taluka Vejalpur in the

District of Ahmedabad & Registration Sub-District of Ahmedabad [PALDI]

Owned by Shrenik Kirtilal Sheth and

boundaries as under: North: Office

No.404, South: Open Space, East:

Passage, West: Open Space.

Date:- 26.08.2025

PLACE: Ahmedahad

NOTICE.

Security Enforcement Rules.

without any further notice.

Corporate Office: 27 A. Developed Industria Estate, Guindy, Chennal - 600032 Registered Office: Plot No. C-21, Tower C (1-3 floors), 6 Block, Bandra Kurla Complex, Bandra (E)

• Website: www.rachanainfra.com • E-mail: rachanainfra404@gmail.com Mumbai-40005.CIN: U65993MH2008PLC384221 NOTICE OF SALE BY PRIVATE TREATY UNDER

Company will be held on Monday, 22nd September, 2025 at 01:00 p.m. (IST) through video conferencing ("VC)/ other audio-visual means ("OAVM") to transact the business, as set out in the Notice of the AGM which is being circulated for convening

business as set forth in the Notice of AGM.

Members can attend and participate in the AGM through the VC/OAVM facility only. The instruction for joining the AGM is provided in the Notice of AGM. Members attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under section 103 of the Companies Act, 2013.

A letter Providing the weblink for accessing the Annual Report for the Financial Year 2024-25 will be dispatched to those shareholders who have not registered their Email. IDs with the company/DPs.

members to cast their votes on all the resolutions which is set out in the Notice of the AGM. Members have the opinion to cast their votes on any of the resolutions using remote e-voting facility or e-voting during the AGM. Detailed procedure for the remote e-voting/e-voting during the AGM is provided in the Notice of the AGM.

Members holding Shares in Demat mode are requested to contact their respective Depository Participant for registering the email addresses.

Manner of remote e - voting and e-voting during the AGM: The Company is proving e voting facility (remote e-voting) to its shareholders to cast their votes on all the resolutions set out in the notice of the AGM. Additionally, the Company is facility of voting through e-voting during the AGM (e-voting). The procedure for remote evoting and e-voting during the AGM by the Shareholders holding shares in electronic

If you have any queries or issues regarding attending AGM & e-Voting from the or contact at toll free no. 1800 21 09911

For Rachana Infrastructure Ltd.

Date: - August 26, 2025

Girishkumar O. Raval Chairman & Managing Director (DIN:01646747)



secured asset. The sale will be done by the undersigned through e-auction platform provided here under

Union Bank Bhavan, Race Course Road, Regional Office Raikot. E Mail: crld.rorajkot@unionbankofindia.bank

E - AUCTION SALE NOTICE (For sale of Immovable/Movable Properties)

Reserve Price/

Scan here

For detailed

Terms & Conditions

indianexpress.com

E Auction Sale Notice for Sale of Movable/Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002

HINDUJA LEYLAND FINANCE LTD

read with provision to Rule 6(2) or 8(6) of Security Interest (Enforcement) Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower/s and Guarantor/s, that the below described movable/immovable property mortgaged / charged to Union Bank Of India (secured creditor), possession of which has been taken by the Authorized Officers of Union Bank of India, will be sold on "AS IS WHERE IS", "AS IS WHAT IS", and "WHATEVER THERE IS" basis, for recovery of respective dues mentioned hereunder against the secured assets mortgaged/charged to Union Bank of India, from respective borrower(s) and guarantor(s). The reserve price and earnest money deposit is shown there against each

AUTHORISED OFFICER

Sr. No.	Name of the Borrower/Guarantor and Branch Details	Description of the properties	Amount to be Recovered	Type of Possession Physical	EMD/ Bid increase amount in Rs
01	Mrs. Sandhiya Devi Harendrabhai Chobey & Mr. Harendra Kumar Kapildev Chobey Branch : Metoda Branch, Rajkot Branch Manager : Mr. Bhagvan Das Contact : M. 97522 44204	Immovable Residential Property i.e. Flat No. 101 on First Floor with Built-up Area adm. 654.30 Sq. Feet., Plot No. 1 & 2, area known as "Anjali Park" of Rev. Survey No. 183 paikee of Village: Khirasara, Tal. Lodhika, Dist. Rajkot in the state of Gujarat. Owned by Mrs. Sandhiya Devi Harendrabhai Chobe. Boundries: North: Margin thereafter Others Property, South: Flat No. 102, East: Margin thereafter Public Road, West: Staircase, Passage there after Flat No. 108	Rs. 10,34,000 as on 30.06.2025 with further interest, cost and expenses		Rs. 6.11 Lakh EMD 10% Bid Increase 1%
02	Dineshpuri Ratanpuri Gusai & Nishaben Dineshpuri Gusai Branch : Madhapar Branch Manager : Mr. Manish Kumar Jha Contact : M. 99718 53642	Residential Sub Plot No. 56/D, Plot No. 56, Survey No. 167, Paiki of Madhapar Seem, Junavas, Madhapar, Bhuj, Kutch, Admeasuring 47.53 Sq. Mtr. Bounded: On the North by: Sub Plot No. 57, On the South by: Sub Plot No. 56/C, On the East by: Internal Road, On the West by: Sub Plot No. 56/A	Rs. 11,83,000 as on 30.06.2025 With further interest at contractual rate and cost thereof.	Symbolic	Rs. 11.46 Lakh EMD 10% Bid Increase 1%
03	M/s. Mann Industries Prop. Naynaben Rajeshbhai Kaila Branch : Morvi Branch Branch Manager : Mr. Narayan Lal Meena Contact : M. 90030 78450	Industrial Land With Allied Civil Construction Work Halwad Rev. Sur. No. 2580/ Paiki 1 & 2581/1 Amalgamated Rev. Sur. No. 2580 Paiki 1, Plot No. 23 Area 348.72 Sq Mtr, C/o. "Mann Industries", Sardar Patel Estate Area Near Pooja Industries & Tulsi PVC Pipe Units Behind To Trufill Polymers, Ahead Of Sanidev Temple Off. Halwad Maliya Highway / Ahmedabad Highway At: Halwad, Taluka: Halwad, District: Morbi. Boundaries: North: Plot No. 22, South: Road, East: Road, West: Sr. No. 2579	Rs. 34,59,000 as on 30.06.2025 with further interest, cost and expenses	Physical	Rs. 12.90 Lakh EMD 10% Bid Increase 1%
04		Residential Flat Situated at Siddharth Appartment Flat No. B-404, Fourth Floor, Nageshwar Parswanath, Ghanteshwar, R. S. No. 28/P, Plot No. 204 to 206, Near Patel Chowk, Jamnagar Road, Rajkot. (Property description as specified in the Sale Deed No. RKT-3-RNP 5548 Dated 24.05.2012) Bounded: On the North: Flat No. 403, On the South: Open Parking and then Wing-A, On the East: Open Parking, then Plot No. 215 to 217, On the West: Stair, Flat No. 401	Rs. 19,87,000.00 as on 30.06.2025 with further interest, cost and expenses	Physical	Rs. 14.15 Lakh EMD 10% Bid Increase 1%

Date and time of Auction: 11.09.2025 from 12.00 NOON to 5.00 PM (UNLIMITED EXTENSION OF 10 MINUTES) Property Inspection (BY TAKING PRIOR APPOINTMENT) Inspection Date: 04.09.2025, Time: 11.00 AM to 4.00 PM

For detailed Terms and Conditions of Sale. Please refer to the link provided in https://www.unionbankofindia.co.in/auction-property/view-auction-property.aspx &

https://baanknet.com Perspective bidders may contact for more details to Mr. M. R. Jadeja - Mob.: 98252 89952 and Mr. Mukeshkumar Meena - Mob: 99604 93547. GST/TDS shall be payable as per applicable Government Rules by purchaser on sale of Movable/Immovable Assets.

AS PER SARFAESI Act, STATUTORY 15 - DAYS SALE NOTICE TO THE BORROWER/ GUARANATOR/ MORTGAGOR

The above mentioned Borrower's is/ are hereby noticed to pay the sum as mentioned in section 13 (2) Notice in full before the date of auction, failing which property will be auctioned/ sold and balance dues if any will be recovered with interest and cost from Borrower's/ Guarantor's/ Mortgagor.

Date: 26.08.2025. Place: Raikot (In The Event Of Any Discrepancy Between The English Version And Any Other Language Version of This Auction Notice, The English Version Shall Prevail)

Authorised Officer, Union Bank of India



I arrive at a conclusion not an assumption.

Inform your opinion with detailed analysis.

The Indian Express. For the Indian Intelligent.

Contact: M. 97277 37232





RACHANA INFRASTRUCTURE LIMITED

Read. Office: 604. 6th Floor, Zion Z-One, Near Hotel Avalon, Off, Sindhubhavan Road. Ahmadabad Guiarat 380054 India • Phone: 079 49172660

Notice To The Members For The 24th Annual General Meeting

NOTICE is hereby given that the Twenty Fourth Annual General Meeting (AGM) of the

The Ministry of Corporate Affairs (MCA) has vide its circular no. 20/2020 dated May 5, 2020 read with circular nos. 14/2020, 17/2020, 02/2021, 19/2021 and 02/2022 dated April 8, 2020, April 13, 2020, January 13, 2021, December 8, 2021 and May 5, 2022, Circular no.10/2022 dated December 28, 2022 and circular No. 09/2023 dated September 25, 2023, provisions of Circular No. 9/2024 dated 19th September 2024 (in continuation with the Circulars issued earlier in this regard) MICA Circulars') read with SEBI Circular No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 dated 3rd October 2024 ('collectively referred as 'MCA and SEBI Circulars' or 'the Circulars'), respectively (collectively referred to as "MCA Circulars") and in Compliance with relevant provisions of the Companies Act, 2013 and SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, the AGM of the members of the Company will be held through VC/OAVM to transact the

In compliance with the Circulars, electronic copies of the Notice and Annual Report 2024-25 will be sent to all the shareholders whose email ids are registered with the Company/Depository Participant(s). These documents will be available on the website of the company at www.rachanainfra.com website of the Stock Exchange i.e. National Stock Exchange of India Limited at www.nseindia.com and on the CDSL website at www.evotingindia.com. The Notice and annual report for the Financial Year 2024-25 will be sent to all the shareholders whose Email. IDs are registered with the Depositories.

The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its Manner of registering and updating email addresses:

mode/physical mode will be provided in the in the Notice of AGM.

The Record date has been fixed as Monday 15th September, 2025 for the purpose of E-voting facility for AGM.

CDSL e-Voting System, you can write an email to helpdesk.evoting@cdslindia.com By Order of the Board of Director

Place:-Ahmedabad

CORRIGENDUM This is with reference to the "ABRIDGE! VEHICLE E-AUCTION NOTICE" published of 18TH AUG 2025, Please read address: Regional

Office, Baroda City Region-II, Eighth Floor, Sura Plaza-I, Sayajiganj, Baroda - 390020, Gujaral Phone: 9716935245 Instead of Regional Office, Baroda District Region-II, Eight Floor, Sura Plaza-I, Sayajiganj, Baroda-390005 Phone: 9874156592 All other terms and conditions remain will same. Date: 26.08.2025 Sd/- Authorized Officer Place: Vadodara Bank of Baroda

GANESH HOUSING LIMITED

(formerly known as Ganesh Housing Corporation Limited) [CIN: L45200GJ1991PLC015817]

Regd.Office: Ganesh Corporate House, 100 Feet Hebatpur-Thaltej Road, Nr. Sola Bridge, Off. S.G. Highway, Ahmedabad - 380 054 (P): +9179 6160 8888 (W): www.ganeshhousing.com (E): secretarial@ganeshhousing.com

NOTICE

Transfer of Equity Shares and unclaimed dividend to Investor Education and Protection Fund (IEPF) Account

This Notice is given pursuant to the provisions of section 124 (6) of the Companies Act, 2013 ("Act") read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 as amended from time to time ("the Rules") that the shares in respect of which dividend has not been paid or claimed by the shareholders for seven consecutive years or more, are to be transferred to the Demat account of the Investor Education and Protection Fund Account ("the IEPF Account").

Pursuant to the provisions set out in the Rules, the Company is communicating through individual notice(s), to the concerned shareholders whose shares are liable to be transferred to IEPF Account under the said Rules for taking appropriate action(s) to claim their unpaid dividend.

The full details of such shares which are due for transfer on October 29, 2025 to IEPF Account, are available on its website at www.ganeshhousing.com and the shareholders are requested to verify the details of the shares liable to be transferred to IEPF Account at weblink http://www.ganeshhousing.com/dividend.html.

The concerned shareholders holding shares in physical form and whose shares are liable to be transferred to IEPF Account may note that as per the requirement of the Rules, the Company would be issuing new share certificate(s) for transfer of such shares to IEPF, in lieu of the original share certificate(s) which are registered in their names and these original share certificate(s) will stand automatically cancelled and be deemed non-negotiable. The shareholders may further note that the details uploaded by the Company on its website shall be considered and be deemed to be adequate notice in respect of issue of the duplicate share certificate(s) by the Company for the purpose of transfer of shares to IEPF Account pursuant to the

In case the Company does not receive any valid claim from the concerned shareholders by October 29, 2025. the Company with a view to comply with the requirements set out in the Rules, shall transfer the corresponding shares and unclaimed dividend (declared by the Company on September 29, 2018) to the IEPF Account by the due dates as per procedure stipulated in the Rules. Concerned shareholders holding shares in dematerialized form may note that the Company shall inform the depository by way of corporate action for transfer of shares in favour of the DEMAT account of IEPF. Please note that no claim shall lie against the Company in respect of unclaimed dividend and equity shares transferred to the IEPF Account/IEPF Authority

Shareholders may note that both the unclaimed dividend and the shares transferred to IEPF Account including all the benefits accruing on such shares, if any, can be claimed back by concerned shareholder from IEPF Account, after following the procedure as prescribed under the Rules.

In case the shareholders have any queries on the subject matter, they may contact the Company's Registrar and Share Transfer Agent - at MCS Share Transfer Agent Limited, Email: mcsstaahmd@gmail.com Contact No. +91 079-26580461/62/63 or write to Company at Email: secretarial@ganeshhousing.com

Date: 25.08.2025 Place: Ahmedabad For Ganesh Housing Limited Jasmin Jani Company Secretary

MACPOWER CNC MACHINES LIMITED

(CIN: CIN: L30009GJ2003PLC043419)

Reg. Office: Plot No. 2234, Near Kranti Gate, GIDC Metoda- 360 021, Talu-Lodhika, Dist-Rajkot, Gujarat, India. • Phone No: 0287 287930 Email:cs@macpowercnc.com • Website:www.macpowercnc.com

NOTICE OF 22nd ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND BOOK CLOSURE

Notice is hereby given that:

 The Twenty Second [22nd] Annual General Meeting of the Company will be held on Wednesday, September 17. 2025 at 02:00 P.M. at registered office of the Company at Plot No. 2234, Near Kranti Gate, GIDC Metoda -360021, Talu-Lodhika, Dist-Rajkot, Gujarat, India.

2. The notice of 22nd AGM and Annual Report of the Company for the Financial Year 2024-25 have been sent only through letter providing web link to those shareholders whose email ID not registered and electronic mode to those the shareholders whose email IDs are registered with the Company/Depository Participant as on 14th August, 2025. Annual Report along with the Notice is also available at the website of the Company https://macpowercnc.com/wp-content/uploads/2025/08/Annual-Report-2024-25.pdf. However, in terms of Regulation 36 (1)(c) of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015, the Company will send hard copy of full annual report to those shareholders who request for the same through e-mail cs@macpowercnc.com

In compliance with provision of section 108 of the Companies Act, 2013 read with rule made thereunder, as amended from time to time and, Regulation 44 of the SEBI [Listing obligations and disclosure requirements] Regulations, 2015, the Company is providing the remote e-voting facility to members to cast their vote by electronically through electronic voting system of MUFG Intime India Private Limited through their Insta Vote platform from a place other than venue of AGM ("remote e-voting"). All members are informed that:

The remote e-voting shall commence on September 14, 2025, Sunday at 9:00 A.M. and ends on September 16, 2025, Tuesday at 05:00 P.M. The remote e-voting module shall be disabled by MUFG Intime India Private

limited thereafter: The cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGM is September 10, 2025. The persons who acquires the shares and becomes the member of the Company after dispatch of AGM notice

The business stated in the notice of 22nd AGM may be transacted through voting by electronic means;

and holding shares as on cut-off date i.e. September 10, 2025 may cast their votes by following instructions and process of remote e-voting as provided in the Notice of AGM.

Shareholders who have not registered their e-mail address and in consequence the Annual Report, Notice of AGM and e-voting notice could not be serviced, may also temporarily provide their email address and mobile number to the Company's Registrar and Share Transfer Agent, MUFG Intime India Private Limited at

In case of any Queries relating to e-voting, member/ beneficial owner may contact MUFG Intime India Private

limited through sending e-mail to enotices@in.mpms.mufg.com Or call us:-+91 2827 287930-2 or 022 -

enotices@in.mpms.mufg.com or write us at cs@macpowercnc.com The members may note that;

Once the e-vote on the resolution is cast by the members, they shall not be allowed to change it subsequently; The facility for voting through ballot paper shall be made available at the AGM for the members who have not cast their vote by remote e-voting;

The members who have cast their vote by remote e-voting may also attend the AGM but shall not be entitled to

cast their vote again and; iv. The person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitle to avail the facility of remote e-voting as well as voting at AGM.

Pursuant to section 91 of the Companies Act, 2013 and applicable rule thereunder, the register of members and share transfer book for Equity Shares of the Company will remain closed from September 11, 2025, Thursday to September 17, 2025 Wednesday [Both days inclusive] for the purpose of Annual General Meeting and Final Dividend for the financial year ended on March 31, 2025.

RAJKOT, DT: 26/08/2025

By Order of the Board MACPOWER CNC MACHINES LIMITED Sd/- RUPESH J. MEHTA **Chairman & Managing Director** DIN: 01474523









બાન્ય ઓફિસઃ એક્સિસ બેન્ક લિમિટેડ, કલેક્શન સેન્ટર, ફર્સ્ટ ફ્લોર, યુનિટ નં.૧૦૧ અને ૧૦૨ (પાર્ટ) બલેશ્વર એવન્યુ એસ જ હાઇવે સામે રાજપથ ક્લબ બોડકદેવ અમદાવાદ ગુજરાત - ૩૮૦ ૦૫૪. **કોર્પોરેટ ઓફિસ**ઃ એક્સિસ બેન્ક લિમિટેડ, ત્રીજો માળ, ગીગાપ્લેક્સ, એનપીસી – ૧, ટીટીસી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, મુગલસન રોડ, એરોલી, નવી મુંબઈ – ૪૦૦ ૭૦૮.

માંગણી સૂચના

ડીમાન્ડ

અમે, એક્સિસ બેંક લિમિટેડ (અગાઉ યુટીઆઈ બેંક લિમિટેડ તરીકે ઓળખાતી હતી.) (હવેથી "ધ બેંક" તરી કે ઉલ્લેખ કરવામાં આવે છે) તેની રજિસ્ટર્ડ ઓફ્સિ ત્રિશૃલ સામર્થેશ્વર કોમ્પ્લેક્સની સામે, લો ગાર્કન, એલિસબી જ, અમદાવાદ - 38006 અન્ય સ્થળો એક્સિસ બેંક લિમિટેડ, પ્રથમ માળ, બોલેશ્વર એવન્યુ, એસ જી હાઇવે, રાજ્યથ કલ્બની સામે, બોડકદેવ, અમદાવાદ, ગુજરાત - 380054 ધરાવે છે અને આ રીતે સિક્યોર્ડ કેડિક્ટ તરીકેની તેની ક્ષમતામાં ઉપરોક્ત કાયદાની કલ્યુ 13 (2) હેઠળ નીટિસ આપશે જ્યારે અહીં ઉલ્લેખિત ઋણધારકો/ગેરેન્ટર્સ/મોર્ગજોએ એક્સિસ બેંક લિ. અમે જણાવીએ છીએ કે નાણાફીય સહ્યનો લાભ લીધો હોવા છતાં. ઋણ લેનારાઓ/ગેરન્ટર્સ/મોર્ગજોએ નિયત તારીખ અનુસાર વ્યાજ અને મુદ્દલની રકમની પુનઃચુકવણીમાં ડિફોલ્ટ કર્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા નિદેશો / માર્ગદર્શિકાઓ અનુસાર આખતાને અહિંક તરીએ નો પરફોર્મિંગ એસેટ તરીકે વર્ગીફત કરવામાં આવે છે. એક્સિસ બેંક લિમિટેડના અધિકૃત અધિકારી ને કિસ્મોરિટાઇઝેશન એન્ડ રિફન્ટ્રફ્શન ઓફ ફાઇની સ્થાઓની સામે ત્રાપ્ત એસેટ્સ એન્ડ એન્ફ્રોસીનેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટર એક્ટ - 200ટ હેઠળ પ્રદુત લાગો આવેલી સત્તાઓ (જાયાં અર્થ) સ્ત્રીને અને કલ્મ 13 (2) હેઠળ પરના કરવામાં આવેલી સત્તાઓ કલ્યા કર્યા હત્યા અપ્ત અને અમલીકરણ) નિયમો, 2002ના નિયમ 3 સાથે વાંચવામાં આવે છે. જાજ અધિકૃત્રને સ્ત્રીન અપ્ત કલ્ય / ગેરેન્ટર્સ / મોર્ગજર્સને નીચે જણાવેલી તારીઓ પર ક્ષુઇનાન્સ એસેટ્સની કલ્ય 13 (2) હેઠળ નીચે જણાવેલી તારીઓ પર ક્ષુઇનાન્સ એસેટ્સની કલ્ય 13 (2) હેઠળ નીચે જણાવેલી તારીઓ પર ક્ષુઇનાન્સ એસેટ્સની કલ્ય 13 (2) હેઠળ નીચે જણાવેલી તારીઓ પર ક્ષિયાનો આવે છે. વ્યાજ અધિસાર તેથી તેમને આ અંગે જાહેર નીટિસ દ્વારા જાણ કરવામાં આવે છે.

ક. ન.	કરજદાર અને સહ - કરજદાર/ જામીનદારનું નામ અને સસ્નામું અને લોન ખાતા નંબર	નોટીસની તારીખ અને NPA ની તારીખ	ડીમાન્ડ નોટીસ મુજબ બાકી રકમ (રૂા. માં)	ગીરવે મૂકાયેલી મિલકત	ન/સુરક્ષા સંપત્તિનુ <u>ં</u>	વર્ણન		
1	1. શ્રી. પટેલ તેજસકુમાર ઘનશ્યામભાઈ (ઉધાર લેનાર/અરજદાર) S/0. ઘનશ્યામભાઈ, 101, અલંકાર સોસાયટી, ભવાની માતનો વાસ, પોર, ગાંધી નગર - 382421. અહીં પણ - દુકાન નં. 121, પહેલો માળ, કાનમ રેસિકેન્સો-II, બ્લોક નં 160 અને 165, ટીપીએસ નં. 6, બ્લોક, મોજે- કુકાસણ. તાલ અને જિલ્લો- ગાંધીનગર - 382421. 2. શ્રીમતી ઘનશ્યામભાઈ સ્વજીભાઈ પટેલ (સહ-અરજદાર) S/0. સ્વજીભાઈ, પોર, ગાંધી નગર. ભવાની માતનો વાસ, પોર, ગાંધી નગર - 382421.	ક્રેમરિંઘલ દુકાન, બ્લોક નં. ૧૬૦ (જુનું આર અરુ.એસ. નં. ૪૫/૭), ડી.ટી.પી નં. દ (કુડાસણ અને બ્લોક નં. ૩૦૨ (જુનું આર.એસ. નં. ૧ ધોળાકુવા- પોર) એક. પ્લોટ નં ૧૩૪ પાયકી. વિસ્તાર ૨૮.૯૮ ચોરસ મી.ટર અને ૧૨.૭૦ ચોર રહેઠાણ-II" તરીકે જાણીતી, મૌજે: કુવસન, તા	પટેલ ની તમામ ભાગ અને હિસ્સા સાથે ન ઈસથવાર મિલકત ની દ૦ (જુનું આર.એસ. નં. ૪૫/૧૦) અને બ્લોક નં. ૧૬૫ (જુનું નં. ૬ (ઠુડાસણ- રાંદેસણ-ધોળાકુવા- પોર), એફ. પ્લોટ નં. ૮૨ ાર.એસ. નં. ૧૭૯/૧), ડી.પી. ટી. નં. ૬ (ઠુડાસણ- રાંદેસણ- ૧૩૪ પાયકો, બ્લોક નં. સી. ૧ માળ, દુકાન નં ૧૨૧, વહીવટી ાને ૧૨.૭૦ ચોરસ મીટર, અવિભાજિત હિસ્સો, યોજના "કાનમ જે: ઠુડાસન, તાલુકા અને પેટા જિલ્લો- ગાંધીનગર ગુજરાત. ચતુઃ શ્વિમઃ પેસેજ, ઉત્તર: દુકાનનં. ૧૨૦, દક્ષિણ: દુકાનનં. ૧૨૨					
2	1. શ્રી પટેલ દેવાભાઈ મોહનભાઈ (લેનારા) પટેલ વાસ. ફાલુ. તાલુકા- વિજાપુર, મહેસાણા – 382860. અહીં પણ - પ્લોટ નં. 82, વિજાપુર સબ માર્કેટ યાર્ડ, હિંમતનગર હાઇલે. સર્વે પ્લ્લોક ને , 2146/1, વિજાપુર, મહેસાણા - 382870. 2. શ્રી રાજેન્દ્રકુમાર દવજીભાઈ પટેલ (સહ- અરજદાર) પટેલ વાસ. ફાલુ. તાલુકા-વિજાપુર, મહેસાણા – 382860. અહીં પણ - પ્લોટ નં 82, વિજાપુર સબ માર્કેટ યાર્ડ, હિંમતનગર હાઇલે. સર્વે/બ્લોક નં. 2146/1, વિજાપુર, મહેસાણા - 382870.	14.07.2025 & 19-05-2024	10,32,020.02	પટેલ દવભાઈ મોહનભાઈ અને રાજેન્દ્રકુમાર દવજીભાઈ પટેલ ની તમામ ભાગ અને હિસ્સા સાથે ની મિલકત નો પ્લીટ નં ૮૨, વિજાપુર સબ માર્કેટ યાર્ડ, સર્વે/બ્લીક નં ૨૧૪૬/૧, વિસ્તાર ૧૧૫.૮૭ ચોરસ મીટર, વિજાપુર, જિલ્લો મહેસાણા ૩૮૨૮૬૦, ચતુઃ સીમા - પૂર્વઃ પ્લીટ નં ૮૩, પશ્ચિમઃ પ્લીટ નં ૮૧, ઉત્તરઃ ખુલ્લી જમીન, દક્ષિણઃ સર્વે નં. ૨૧૪૫.				
3	1) મેસર્સ રિદ્ધિ કેટલ ફીડ ઇન્ડસ્ટ્રીઝ(ઋણ લેનાર/ગીરો) તેના ભરતકુમાર નટવરભાઈ પટેલ, 3. શ્રી જયેશકુમાર પુંજાભાઈ પટેલ સાબરકાંઠા- 383235. 2) શ્રી અનંતકુમાર નટવરભાઈ પટેલ(સહ ૧૪ ટકાં/ રિદ્ધિ કેટલ ફીડ ઇન્ડસ્ટ્રીઝ, ઘરોડ, વડાલી, સાબરકાંઠા- 38 383255. 3) શ્રી ભસ્તકુમાર નટવરભાઈ પટેલ(સહ-ઋણ લેનાર 28/P, રિદ્ધિ કેટલ ફીડ ઇન્ડસ્ટ્રીઝ, ધરોડ, વડાલી, સાબરકાંઠા- 383255. શ્રી જયેશકુમાર પુંજાભાઈ પટેલ(સહ-ઋણ લેનાર/ ભાગીદાર ઇન્ડસ્ટ્રીઝ, ધરોડ, વડાલી, સાબરકાંઠા- 383255. અહીં પણ ગુજરાત-383255. 5) શ્રી પુંજાભાઈ @ પુંજીચમ જીવાભાઈ પટેલ	દવી મંદિર. અર્બુદાનગર, વડાલી, લ ફ્રીડ ઇન્ક્સ્ટ્રીઝ. ઘરાડ વડાલી, ડિંકા નંબર 486/2, જુના SR નંબર વાસણા, સાબરકાંઠા. ગુજરાત- નંબર 486/2, જુના SR નંબર 78 શાબરકાંઠા, ગુજરાત- 383255. 4) 27-06-2025 ર નંબર 78 28/P, રિદ્ધિ કેટલ ફ્રીડ વાસણા, વાસણા, સાબરકાંઠા,	00,48,184.48/-	તમામ ભાગ અને હિસ્સા સાથે ની સ્થાવર મિલકત N A સર્વે નં. 486/2 (જૂની એસ નં 78 પાઇકી 28), 3000 ચોરસ મીટરનું માપન, ગામ ઘરોડ તાલુકો - વડાલી, જિલ્લો સાબરકાંઠા, ચઠ્ઠા સીમા- પૂર્વ એસ. નં. ૭૮ પાયકી, દક્ષિણ એસ. નં. ૭૮ પાયકી, દક્ષિણ એસ. નં. ૭૮ પાયકી, ઉત્તર એસ. નં. ૭૮ પાયકી, ઉત્તર				

. કપા કરીને વધુનોંધ લેશો કે ઉપરોક્ત અધિનિયમની કલમ 13 નો પેટા-કલમ 13 માં ઉલ્લેખ કર્યા મુજબ, તમે જામીનગીરી હેઠળ જણાવેલી કોઈપણ સંપત્તિને વેચાણ, ભાડા પટ્ટા અથવા અન્યથા સ્થાનાં તરિત કરી શકશ નહીં અમારી બેંકની આગોત્તરી લેખિત સંમતિ વિના આનીટિસમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તારીખ - ૨૬.૦૮.૨૦૨૫, સ્થળ - ગુજરાત

નોંધ : (વિવાદ ની સ્થિતીમાં અંગ્રેજી આવૃતિને માન્ય રાખવામાં આવશે)

અધિકૃત અધિકારી, એક્સિસ બેંક લિ

ATHER

ATHER ENERGY LIMITED

(formerly known as Ather Energy Private Limited) CIN: L40100KA2013PLC093769

Registered Address: 3rd Floor, Tower D, IBC Knowledge Park, #4/1, Bannerghatta Main Road, Bengaluru-560029, Karnataka, India Website: www.atherenergy.com, Email: cs@atherenergy.com Tel: +91 80 6646 5750

NOTICE OF THE 12[™] ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

Notice is hereby given that the 12th Annual General Meeting ("AGM") of the members of Ather Energy Limited (the "Company") will be held on Wednesday, September 17, 2025 at 11:00 AM (IST) through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM"). In compliance with General Circular No. 14/2020 dated April 8, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020, General Circular No. 20/ 2020 dated May 05, 2020, and subsequent circulars issued in this regard, the latest being 09/2024 dated September 19, 2024 issued by Ministry of Corporate Affairs ("MCA") and SEBI/HO/CFD/ CFD-PoD-2/P/CIR/2024/133 dated October 3, 2024 issued by Securities and Exchange Board of India ("SEBI") (hereinafter collectively referred to as "the Circulars"), Companies are allowed to hold AGM through VC/OAVM facility, without the physical presence of members at a common venue. Accordingly, the AGM of the Company is being held through VC to transact the business as set forth in the Notice of the AGM dated August 04, 2025.

In compliance with the Circulars, the Notice of AGM and Annual Report for the FY2024-25 have been sent electronically to all the members whose email addresses are registered with the Company Registrar and Share Transfer Agent ("RTA")/Depositories as on August 22, 2025. These documents are also made available on the website of the Company at www.atherenergy.com/investor-relations/financials, websites of the Stock Exchanges i.e. BSE Limited ("BSE") at www.bseindia.com and National Stock Exchange of India Limited ("NSE") at www.nseindia.com and on the website of National Securities Depository Limited ("NSDL") at www.evoting.nsdl.com. The dispatch of the Notice of AGM and Annual Report through emails has been completed on Monday, August 25, 2025. A Letter providing the web-link including the exact path for accessing the Notice of AGM and Annual Report for the FY2024-25 is also being dispatched to those members who have not registered their email addresses. The procedure to join the meeting through VC/OAVM is provided in the Notice of AGM.

Members holding shares as on the cut-off date i.e. September 10, 2025 may cast their vote electronically on the business as set out in the Notice of the AGM through electronic voting system ("e-voting") of NSDL. All the members are informed that:

- The business as set forth in the Notice of the AGM may be transacted through remote e-voting or e-voting at the AGM;
- The cut-off date for determining the eligibility to vote by remote -voting or e-voting at the AGM is Wednesday, September 10, 2025:
- The remote e-voting shall commence on Sunday, September 14, 2025 (09:00 AM (IST));
- The remote e-voting shall end on Tuesday, September 16, 2025
- The remote e-voting module will be disabled by NSDL after 05:00 PM (IST) on September 16, 2025;
- vi. Any person who acquires shares of the Company and becomes a member of the Company after the Notice is sent and holding shares as of the cut-off date, i.e September 10, 2025, may obtain the login ID and password to access the e-voting portal of NSDL by sending a request at evoting. However, if a person is already registered with NSDL for e-voting, then the existing user ID and password can be used.
- vii. Members may note that: a) Once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) The facility for e-voting will also be made available during the AGM for those members who have not cast their vote during the remote e-voting period; c) The members who have cast their votes by remote e-voting prior to the AGM may attend the AGM but shall not be entitled to cast their votes again; and d) Only persons whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date i.e. September 10, 2025 shall be entitled to avail the facility of remote e-voting or e-voting at the AGM.
- viii. The manner of remote e-voting and e-voting at the AGM for members holding shares in dematerialized mode and who have not registered their email addresses, is provided in the Notice of the AGM which is also available on the Company's website as well as the website of the BSE, NSE and NSDL
- Members holding shares in dematerialized mode and who have not registered/updated their e-mail address are requested to register/update their email address with their respective Depository through their Depository Participant(s) with whom they have Demat Account(s). This will enable the shareholders to receive electronic copies of the Annual Report, Notice, instructions for remote e-voting, instructions for participation in the AGM through VC.
- For details relating to e-voting, please refer to the Notice of the AGM. In case of any assistance before or during the AGM, members may write to Ms. Puja Aggarwal, Company Secretary & Compliance Officer at 13th Floor, Tower D, IBC Knowledge Park, #4/1, Bannerghatta Main Road, Bengaluru-560029, Karnataka India or at email ID: cs@atherenergy.com or contact the Company on +91 80 6646 5750. The members may also refer the Frequently Asked Questions (FAQs) for shareholders and e-voting user manual for shareholders available at the download section of www.evoting.nsdl.com or call on: 022-4886 7000 or send a request to Mr. Amit Vishal, Asst Vice President, NSDL at T301, 3rd Floor, Naman Chambers, G Block, Plot No-C-32, Bandra Kurla Complex, Bandra East, Mumbai-400051 or at email ID: evoting@nsdl.com for any queries or grievances connected with facility for voting.

This notice is being issued for the information and benefit of all the members of the Company and is in compliance with the applicable Circulars of MCA and SEBI.

Date: August 25, 2025

Place: Bengaluru

For Ather Energy Limited

Puja Aggarwal Company Secretary & Compliance Officer Membership No.: A49310

NATIONAL TEXTILE CORPORATION LIMITED, (WRO), MUMBAI NTC House, 15 N. M. Marg, Ballard Estate, Mumbai - 400 001 Tel. No.: +91 22 22686600 Fax: +91 22 22686631, Website: www.ntcltd.org

TENDER NOTICE FOR SALE OF TRANSFERABLE DEVELOPMENT RIGHTS (TDR)

NTC invites e-tender cum e-auction through
MSTC Ref. no. MSTC/WRO/NATIONAL TEXTILE CORPORATION
LTD/4/BALLARD ESTATE/25-26/28131

Under two bids system from reputed bidders for "SALE OF TDR." Interested bidders may please visit website for detail tender document https://www.mstcecommerce.com or www.ntcltd.org & https://eprocure.gov.in Date of closing of Online e-tender for submission of Technical & Financial bids is 12/09/2025

General Manager(AM).

લિંકન ફાર્માસ્થુટિકલ્સ લિમિટેડ

CIN: L24230GJ1995PLC024288

રજી.ઓફીસ : "લિંકન હાઉસ", સત્યમ કોમ્પલેક્ષની પાછળ, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦ ૦૬૦. ગુજરાત, ભારત. ફોન : + ૯૧-૭૯-૪૧૦૭-૮૦૦૦ ฮ-भेव: investor@lincolnpharma.com • येผลเฮะ: www.lincolnpharma.com નોટીસ

આથી નોટિસ જાહેર કરવામાં આવે છે કે કંપની બાબતોના મંત્રાલય દ્વારા તારીખ ૦૮, એપ્રિલ, ૨૦૨૦ ના રોજ જારી કરાયેલ પરિપત્ર નં. ૧૪/૨૦૨૦ તથા તારીખ ૧૩ એપ્રિલ, ૨૦૨૦ ના રોજ જારી કરાચેલ પરિપત્ર નં. ૧૭/૨૦૨૦ તથા ત્યારબાદ તારીખ ૦૫ મે, ૨૦૨૦ના રોજ જારી કરાચેલ પરિપત્ર નં. ૨૦/૨૦૨૦ અને આ સંદર્ભમાં અન્ય તમામ અનુગામી પરિપત્રો જેમાંથી તારીખ ૧૯ સપ્ટેમ્બર, ર૦૨૪ના રોજ જારી કરાયેલ તાજેતરનું પરિપત્ર નં. ૦૯/૨૦૨૪ તથા સેબીના પરિપત્ર નં. SEBI/HO/CFD/POD-2/P/CIR/2023/4 તારીખ ૦૫ જાન્યુઆરી, ૨૦૨૩ અને સમયાંતરે જારી કરાયેલા અન્ય તમામ પરિપત્રો જેમાંથી તારીખ ઓક્ટોબર ૦૩. ૨૦૨૪ ના પરિપત્ર નં. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 અનુપાલન અંતર્ગત લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની ૩૧મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) સામાન્ય સ્થળે સભ્યોની રૂબરૂ હાજરી વિના વિડિઓ કોન્ફેરેન્સ (VC)/અન્ય દૃશ્ય-શ્રાવ્ય (OAVM) ના માધ્યમથી મંગળવાર, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ૧૧.૦૦ કલાકે ચોજાશે.

ઉપરોક્ત પરિપત્રોનું પાલન કરીને, એજીએમની સચનાની ઇલેક્ટોનિક નકલો અને વાર્ષિક અફેવાલ ૨૦૨૪-૨૫ તે બધા શેરફોલ્ડરોને મોકલવામાં આવશે, જેમની ઇમેઇલ આઈડી કંપની/ડિપોઝિટરી સફભાગીઓ સાથે નોંધાયેલ છે. ડિમેટિલાઇઝ્ડ મોડમાં શેર ધરાવતા શેરફોલ્ડરોને તેમના સંબંધિત ડિપોઝિટરીઓ સાથે તેમના ડિપોઝિટરી સહભાગીઓ દ્વારા તેમના ઇમેઇલ આઈડી અને મોબાઇલ નંબરોની નોંધણી કરવા વિનંતી છે. ઉપરોક્ત પરિપત્રોને અનુલક્ષીને, વાર્ષિક અહેવાલની ભૌતિક(પેપર) નકલો મોકલવાની આવશ્યકતા સાથે વિતરિત કરવામાં આવી છે. જો કે, કંપની વાર્ષિક અફેવાલની ભૌતિક(પેપર) નકલ તે જ સભ્યોને મોકલશે જેઓએ investor@lincoInpharma.com_ઇ-મેઇલ આઈડી પર તેમના ફ્રેલિયો નંબર/ડીપી આઈડી અને ક્લાયંટ આઈડી સાથે વિનંતી કરી હશે. વધારામાં, સૂચિ નિયમોના નિયમન 36(૧)(બી) અનુસાર, વાર્ષિક અફેવાલ સુધી પહોંચવા માટે વેબ લિંક પ્રદાન કરતો પત્ર તે સભ્યોને મોકલવામાં આવશે જેમણે કંપની/રજિસ્ટ્રાર/ડી.પી. સાથે તેમના ઇ-મેઇલ આઈડી નોંધાવ્યા નથી

- ૩૧મી વાર્ષિક સામાન્ય સભાના (એજીએમ) વાર્ષિક અહેવાલ સાથે સૂચના મેળવવા માટે ભૌતિક (પેપર)શેરધારકોના ઇ-મેઇલ આઈડીને અપડેટ કરવાની રીત:
- તે સભ્યો કે જેઓ ભૌતિક (પેપર) સ્વરૂપમાં શેર ધરાવે છે અને કંપની સાથે તેમના ઇ-મેઇલ આઈડી અપડેટ કર્યા નથી, તેમને આરટીએ એટલે કે એમયુએફજી ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને ૫માં માળ, ૫૦૬ થી ૫૦૮, અમરાનાથ બિઝનેસ સેન્ટર-1 (એબીસી-1), ગાલા બિઝનેસ સેન્ટરની બાજુમાં, સેન્ટ ઝેવિયર કોલેજ કોર્નર નજીક, ઑફ સી. જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯, ને યોગ્ય રીતે ફાઇલ કરેલા અને સહી કરેલા ફોર્મ ISR -1 સબમિટ કરીને તે જ અપડેટ કરવાની વિનંતી કરવામાં આવી છે.
- ઇ-વોટિંગ દ્વારા મત આપવાની રીત:

કંપનીના સભ્યોને વીસી (vc)/ દૃશ્ય-શ્રાવ્ય (одvм) દ્વારા મીટિંગમાં ભાગ લેવાની સુવિધા અને ઉપરોક્ત જણાવેલ પરિપત્રોના પાલનમાં ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા મીટિંગ દરમિયાન મતદાનની સુવિધા પ્રદાન કરવામાં આવશે. જેઓ કટ- ઑફ તારીખ (એટલે કે ૨૩.૦૯.૨૦૨૫) ના રોજ શેર્સ ધરાવે છે તથા જેમાં કંપની / આરટીએ સાથે ઇ- મેઇલ આઈડીની બિન-ઉપલબ્ધતા લીધે કંપનીના વાર્ષિક અફેવાલની ઇલેક્ટ્રોનિક નકલ પ્રાપ્ત થઈ નથી તે સહિત બધા સભ્યો એજીએમની નોટિસમાં આપવામાં આવેલી સૂચનાઓને અનુસરીને તેમના મતનો ઉપયોગ કરી શકે છે.

બુક કલોઝર અને અંતિમ ડિવિડન્ડ:

સભ્યો નોંધ કરી શકે છે કે ૨૨ મે,૨૦૨૫ ના રોજ યોજાયેલી તેની બેઠકમાં બોર્ડ ઓફ ડિરેક્ટરએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ. ૧૦ની મૂળ કિંમતના પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂ. ૧.૮૦ (એક રૂપિયો અને એશી પૈસા) (એટલે કે ૧૮%) ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરેલ છે. અંતિમ ડિવિડન્ડ સભ્યોની મંજૂરીને આધિન તે બધા સભ્યોને 30 દિવસની કાનૂની સમય મર્યાદામાં વિવિધ ઓનલાઈન ટ્રાન્સફર મોડ દ્વારા યોગ્ય યુકવણી કરવામાં આવશે, જેમના નામ સભ્યોના રજિસ્ટરમાં કટ ઑફ ડેટ એટલે કે, શુક્રવાર, ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫, બુક કલોઝર તારીખો શરૂ થયાના એક દિવસ પહેલા, એટલે કે શનિવાર, ૧૩મી સપ્ટેમ્બર, ૨૦૨૫ થી મંગળવાર, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ (બંનેદિવસ સમાવિષ્ટ) માં દેખાય છે.

• ડિવિડન્ડ પ્રાપ્ત કરવા માટે બેંકની વિગતો સહિત કેવાયસીની નોંધણી કરવાની રીત:

અંતિમ ડિવિડન્ડ પાત્ર સભ્ય (ઓ) ને સીધા ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ (ઇસીએસ)/ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (એનએસીએય) વગેરે દ્વારા સંબંધિત બેંક ખાતાઓમાં જમા કરવામાં આવશે. ભૌતિક(પેપર) સ્વરૂપમાં શેર ધરાવતા સભ્યોને કોઈપણ વિલંબ કર્યા વિના ડિવિડન્ડ પ્રાપ્ત કરવા માટે કોર્મ આઇએસઆર -1 જરૂરી દસ્તાવેજોની સાથે, સભ્યના નામનો મૂળ ૨દ કરેલો ચેક, બેંક ખાતાઓની વિગતો અને બધા ધારકોના પાન કાર્ડની સ્વ-પ્રમાણિત નકલ અને કંપનીમાં નોંધાયેલા પ્રથમ ધારકના સરનામાના સમર્થનમાં કોઈપણ દસ્તાવેજ (જેમ કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણી ઓળખ કાર્ડ, પાસપોર્ટ)ની સ્વપ્રમાણિત ફોટોકોપી.સાથે મેસર્સ એમયુએફજી ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને પમાં માળ, ૫૦૬ થી ૫૦૮ અમરનાથ બિઝનેસ સેન્ટર-1 (એબીસી-1), ગાલા બિઝનેસ સેન્ટરની બાજુમાં, સેન્ટ ઝેવિયર ક્રોલેજ ક્રોર્નર નજીક, ઑફ સી. જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-3 cooce પર સબમિટ કરવા વિનંતી કરવામાં આવે છે અને ડીમેટ મોડમાં શેર ધરાવતા તમામ પાત્ર શેરધારકોને તેમના સંબંધિત ડિપોઝિટરી સફભાગીઓ સાથે ૯ અંકનો MICR કોડ અને ૧૧ અંકનો IFSC કોડ, ઈ-મેલ આઈડી અને મોબાઇલ નંબર સહિત તેમનો બેંક એકાઉન્ટ નંબર અપડેટ કરવા વિનંતી છે.

એજીએમની નોટિસ કંપનીની વેબસાઈટ https://www.lincoInpharma.com investor/ disclosures-under-regulation-46-of-the-lodr/annual-report તથા સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ www.bseindia.com તથા www.nseindia.com પર ઉપલબ્ધ રહેશે. લિંકન ફાર્માસ્થુટીકલ્સ લિમિટેડ, વતી સહી/

થળ : અમદાવાદ. તારીખ : ૨૫ ઓગસ્ટ, ૨૦૨૫

तुषा शा કંપની સેકેટરી અને કંપલાયન્સ ઓફીસ મેમ્બરશિપ નં. A59416

IRCON INTERNATIONAL LIMITED

NAVRATNA COMPANY
(A Govt. of India Undertaking)
Cin: L45203DL1976G01008171

Regd. Off.: C-4, District Centre, Saket, New Delhi-110017, INDIA
Tel. No.: +91-11-26530266 Fax: +91-11-26854000,
Web: water issen or accessing the property of the pr

Notice of 49th Annual General Meeting and E-voting Information

Notice is hereby given that the 49th Annual General Meeting ("AGM/ Meeting") of the members of the Company will be held on Thursday, the 18" September, 2025 at 12:30 P.M. through Video Conferencing ("VC")/ Other Audio Visual Means ("OAVM") to transact the businesses as set forth in the Notice of the AGM. The Notice of AGM along with the Annual Report for the year ended 31"March, 2025 has been sent by email to the members whose email addresses are registered with the Company/depositories, in compliance with the applicable provisions of the Companies Act, 2013 ("Act") and the Rules made thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations") read with General Circular dated 19" September, 2024 issued by Ministry of Corporate Affairs ("MCA") and SEBI Circular dated 3" October, 2024 (collectively referred to as "Circulars").

Notice of the AGM and Annual Report of FY 2024-25 are also available Company's website: www.ircon.org under the 'INVESTORS RELATIONS' section and website of stock exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively. The AGM Notice is also available at website of National Securities Depository Limited ("NSDL") at www.evoting.nsdl.com.

The Final Dividend as recommended by the Board of Directors, if declared at the AGM will be paid from **Wednesday**, **1**** **October**, **2025** onwards to those Members, whose names appear on the Register of Members of the Company in respect of physical shares and in respect of dematerialized shares, to the "beneficial owners" of the shares whose names appear in the Statement of Beneficial Ownership furnished by National Securities Depository Limited and Central Depository Services (India) Limited as at the close of business hours on Thursday, 11th September, 2025 ("Record Date"). Payment of dividend will be subject to deduction of Tax at Source (TDS) at applicable rates. The details and documents for exemption from TDS may be uploaded online https://einward.alankit.com/ by 05.00 P.M. IST on or before Thursday, 11th September 2025 for more details, please refer to the Notice of ACM. September, 2025. For more details, please refer to the Notice of AGM.

In accordance with Section 108 of the Act read with Rule 20 of the Compani (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI Listing Regulations, and as per MCA Circular, the members are provided with the facility to cast their vote on all resolutions set forth in the Notice of AGM using electronic voting system (remote e-voting and e-voting on the day of AGM) provided by NSDL. Individual members holding securities in Demat mode are allowed to vote through their demat account maintained with Depositories and Depository Participants All the members are therefore hereby informed that:

- The remote e-voting period will commence on Monday, 15th September, 2025 (09.00 A.M. IST) and ends on Wednesday, 17th September, 2025 (05.00 P.M. IST). The remote e-voting shall be disabled by NSDL thereafter and the facility will be blocked forthwith.
- The cut-off date for determining the eligibility to vote through remote e-voting or at the AGM will be **Thursday**, 11th **September**, 2025. During remote e-voting period, shareholders of the company holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date i.e. Thursday, 11" September, 2025 may cast their vote electronically. Once the vote on a resolution is cast by a Member, the Member shall not be allowed to change it subsequently
- Any Person who has acquired shares and becomes Member of the Company after the notice of the AGM has been sent electronically but before the cut-off date of Thursday, 11th September, 2025, may obtain their user ID and password as per the procedure prescribed in the Notice of AGM. Alternatively, shareholder/ members may send a request to evoting@nsdl.co.in for procuring user id and password for e-voting by providing docu documents in the Notice of AGM.
- Those Members, who shall be present in the AGM through VC/OAVM facility and had not cast their votes on the resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM. The Members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their vote again at the AGM.
- Shri Sachin Agarwal, Practicing Company Secretary (Membership no. F5774), partner of M/s Agarwal S. & Associates, Company Secretaries has been appointed as Scrutinizer for conducting the e-voting process in a fair and

nportant Information

- (a) Opening of Special Window for Re-lodgment of Transfer Requests for Physical Shares: Pursuant to SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated 2rd July, 2025, a special window has been opened for a period of six months from 7th July, 2025 to 6th January, 2026 for re-lodgment of physical share transfer requests which were lodged prior to 1" April, 2019 and subsequently rejected, returned, or not attended due to deficiencies in documents or process. As per the said circular, such shares, if re-lodged, shall be processed for transfer only in dematerialized form after following due procedure. Shareholders who fall within this category are advised to contact the Company at its e-mail id investors@ircon.org or to Alankit Assignments Limited ("Alankit" or "RTA") at its e-mail id rameshk1@alankit.com. The details of the above SEBI Circular are also available on the website of the Company at https://www.ircon.org/images/file/cosecy/SEBICIRCULAR_02072025.pdf
- (b) 100- Days Campaign- "Saksham Niveshak": The Investor Education and Protection Fund Authority (IEPFA), under the MCA has launched a nationwide 100-days campaign titled "Saksham Niveshak", from 28" July, 2025 to 6" November, 2025, for enhancing investor awareness and facilitating the recovery of unclaimed dividends and shares. The shareholders of the Company are encouraged to update their KYC details, e-mail addresses, bank mandates, and contact information, including registration of email addresses, within the campaign period to ensure timely and effective communication from the Company. This will enable the Company to make future payments of dividends to the rightful claimant directly, avoiding transfer of any unclaimed amount to IEPF Authority.

ers are requested to read the instructions pertaining to e-voting as printed in the AGM Notice carefully. In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on 022 - 4886 7000 or send a request to (Ms. Pallavi Mhatre - Senior Manager NSDL) at evoting@nsdl.com

lace: New Delhi Date: 25th August, 2025

For Ircon International Limited Pratibha Aggarwal Company Secretary & Compliance Officer

મેસર્સ એફપીએલ મરકચુરી પ્રાઇવેટ લીમીટેડ દ્રારા સાર્વજનિક જાહેરાત

આથી જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે મેસર્સ એફપીએલ મરકયુરી પ્રાઇવેઠ લીમીટેડ તરફ થી ૬૬ કેવી વીજરેષા લાઇન ૬૬ કેવી બારપટોળી જેટકો સબસ્ટેશન ગામ બારપટોળી તાલુકા રાજુલા જિલ્લો અમરેલી થી ૬૬ કેવી મેસર્સ એકપીએલ મરકપુરી પ્રાઇવેટ લીમીટેડના હાઇબ્રીડ (વિન્ડુ અને સોલાર) પ્રોજેકેટ સબ્-સ્ટેશનુ ગામ બારપટોળી, તાલુકા રાજુલા જિલ્લો અમરેલી બસ્ટેશન સુધી દ્દ કેવી ટાવર અને એક્વડી એએલ−૫૯ પેન્થર કડકટર તેમજ અમુક ભાગ મા દદ

કેવી અન્ડરગ્રાઉન્ડ કેબલ દ્રારા પ્રસ્થાપિત કરેલ છે. ઉપરોક્ત ૬૬ કેવી વીજરેષામાં તારીખ ૨૫.૦૮.૨૦૨૫ અથવા ત્યાર પછીના કોઇ પણ દિવસે વીજળી નો પ્રવાહ નિયમિત રીતે વહેતો કરવામાં આવનાર છે.

ઉપરોક્ત ૬૬ કેવી ટાવર લાઇન નીચે કાચું કે પાકું બાંધકામ કરવું નહિ. ૬૬ કેવી ટાવર ડપરાક્ષત કર કવા દાવર લાઇન નાય કાયુ કે પાકુ બાઘકામ કરવુ નાઇ. કર્ક કવા દાવર સ્ટ્રકચર ઉપર ચડવું નહિ. આ લાઇન સાથે કોઇપણ પ્રકરના ચેડા કરવા નહિ તથા ટાવર સ્ટ્રકચર સાથે ઢોક ઢાખર બાંધવા નહિ. તે અત્યંત જોખમ ભરેલું છે. દર કેવી અન્ડરગ્રાઉન્ડ કેબલ નજીક કાર્યું કે પાકું બાંધકામ કરવું નહિ તેમજ અન્ડરગ્રાઉન્ડ કેબલ લાઇન ના રૂટ ઉપર કોઇ પણ પ્રકારનું ખોદકામ કરવું નહિ. આમ છતાં આ ચેતવણી નો અનાદર કરી કોઇ વ્યક્તિ જાણ્યે – અજાણ્યે આવું કૃત્ય કરશે તો ઇન્ડિયન ઇલેક્ટ્રીસીટી એક્ટ હેઠ્ળ કાયદેસર નો ગુનેગાર્ ગુણાશે તેમજ જો કોઇ અકસ્માત થશે તો મેસર્સ એકપીએલ મરકયુરી પ્રાઇવેટ લીમીટેડ જવાબદાર રહેશે નહિ.

ઉપરોક્ત ૬૬ કેવી ટાવર લાઇન તેમજ અન્ડરગ્રાઉન્ડ કેબલ લાઇન રૂટ નીચે દર્શાવેલ વિસ્તાર માંથી પસાર થાય છે: જિલ્લો અમરેલી, રાજુલા તાલુકાના, નવી બારપૃટોળી જૂની બારપટોળી ગામ અને તેની સીમ તથ

તેનો આજુબાજુ નો વિસ્તાર તેમજ પ્રત્યેક ગામો ની વચ્ચે નો વિસ્તાર. માટે અને વતી.

મેસર્સ એફપીઇએલ મરક્યુરી પ્રાઇવેટ લીમીટેડ, અરવિંદ રાણા, પ્રોજેકટ મેનેજર, હૈદરાબાદ, તેલંગાના.

Rachana

રચના ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ

રજિ. ઓફિસ : ૬૦૪, ૬<u>ક્</u>કો માળ, ઝિઓન ઝેડ-વન, હોટેલ એવલોન પાસે, નજીક સિંધુભવન રોડ, અમદાવાદ ગુજરાત ૩૮૦૦૫૪ **- ફોન:** ૦૭૯ ૪૯૧૭૨૬૬૦ **વેબસાઈટ:** www.rachanainfra.com **- ઈ - મેલ:** rachanainfra404@gmail.com

ર૪ મી વાર્ષિક સામાન્ય સભાને લાગતી નોટિસ

આથી સૂચિત કરવામાં આવે છે કે કંપનીની ૨૪મી વાર્ષિક સામાન્ય સભા (એ.જી.એમ) સોમવાર, ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ બપોરે ૦૧:૦૦વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ ("વી.સી")/અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ ("ઓએવીએમ") દ્વારા એ.જી.એમ.ની નોટિસમાં દર્શાવેલ ઠરાવોને મંજર કરવા રાખવામા આવેલ છે.

કોર્પોરેટ અફ્રેયર્સ મંત્રાલય (MCA) એ પોતાના સર્ક્યુલર નં. ૨૦/૨૦૨૦ તારીખ ૦૫ મે, ૨૦૨૦ સાથે વાંચવા યોગ્ય સર્ક્યુલર નં. ૧૪/૨૦૨૦, ૧૭/૨૦૨૦, ૦૨/૨૦૨૧, ૧૯/૨૦૨૧ અને ૦૨/૨૦૨૨ તારીખે ૦૮ એપ્રિલ, ૨૦૨૦, ૧૩ એપ્રિલ, ૨૦૨૦, ૧૩ જાન્યુઆરી, ૨૦૨૧, ૦૮ ડિસેમ્બર, ૨૦૨૧ અને ૦૫ મે, ૨૦૨૨ તથા સર્ક્યુલર નં. ૧૦/૨૦૨૨ તારીખ ૨૮ ડિસેમ્બર, ૨૦૨૨ અને સર્ક્યુલ૨નં. ૦૯/૨૦૨૩ તારીખ૨૫ સપ્ટેમ્બ૨, ૨૦૨૩ અને સર્ક્યુલ૨નં. ૯/૨૦૨૪ તારીખ ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ (પૂર્વે બહાર પાડેલ સર્ક્યુલરનો ચાલુ રાખતા) તથા SEBI સર્ક્યુલર નં. SEBI/HO/CFD/CFD-PoD-૨/P/CIR/૨૦૨૪/૧૩૩ તારીખ ૦૩ ઑક્ટોબર. ૨૦૨૪ સાથે વાંચીને (જેને એકત્રિત રીતે "MCA અને SEBI સર્ક્યુલર્સ" અથવા "સર્ક્યુલર્સ" તરીકે ઓળખવામાં આવે છે), કંપની અધિનિયમ, ૨૦૧૩ તથા SEBI (લિસ્ટિંગ ઓબ્લિગેશન અને ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) નિયમો, ૨૦૧૫ના સંબંધિત જોગવાઈઓના અનુસંધાનમાં કંપનીની સભ્યોની AGM VC/OAVM દ્વારા યોજાશે, જેમાં AGMની નોટિસમાં દર્શાવેલ કાર્યો કરવામાં આવશે.

સર્ક્યલર્સના ભાગ૩પે. વાર્ષિક અહેવાલ ૨૦૨૪-૨૫ તથા AGM નોટિસની અને વાર્ષિક અહેવાલની ઇલેક્ટ્રોનિક નકલ કંપની/ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સાથે ઇ-મેઇલ આઈ.ડી. નોંધાવેલ તમામ શેરહોલ્ડરોને મોકલવામાં આવશે. આ દસ્તાવેજો કંપનીની વેબસાઇટ www.rachanainfra.com, સ્ટોક એક્સચેન્જ એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ www.nseindia.com તથા CDSL www.evotingindia.com પર ઉપલબ્ધ રહેશે. AGM નોટિસ ઇ-મેઇલ દ્વારા મોકલણી. સભ્યો AGMમાં માત્ર VC/OAVM સુવિધા દ્વારા હાજરી આપી શકશે અને ભાગ લઈ શકશે. AGMમાં જોડાવા માટેની સૂચના AGM નોટિસમાં આપવામાં આવી છે.VC/0AVM દ્વારા સભામાં હાજર રહેનારા સભ્યોને કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૦૩ મુજબ ક્વોરમની ગણતરીમાં સામેલ કરવામાં આવશે.

વિત્તીય વર્ષ ૨૦૨૪-૨૫ના વાર્ષિક અહેવાલ સુધી પહોંચવા માટેની વેબલિંક ધરાવતું પત્ર, જેઓએ કંપની/DP સાથે પોતાની ઇ-મેઇલ આઈ.ડી. નોંધાવી નથી, એવા શેરહોલ્ડરોને વેબલિંક ધરાવતું પત્રમોકલવામાં આવશે.

કંપની તેના તમામ સભ્યોને રિમોટ ઈ-વોટિંગ ("remote e-voting")ની સુવિધા પ્રદાન કરે છે જેથી તેઓ AGM નોટિસમાં દર્શાવેલ તમામ ઠરાવ પર પોતાનો મત આપી શકે. સભ્યોને રિમોટ ઈ-વોટિંગ સુવિધાનો ઉપયોગ કરીને અથવા AGM દરમિયાન ઈ-વોટિંગ દ્વારા કોઈપણ ઠરાવ પર મત આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. રિમોટ ઈ-વોટિંગ/AGM દરમિયાન ઈ-વોટિંગની વિગતવાર પ્રક્રિયા AGM નોટિસમાં આપવામાં આવી છે.

ઈ-મેઇલ સરનામું નોંધશી અને સુધારવાની રીત:

ડિમેટ મોડમાં શેર ધરાવતા સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાની સંબંધિત

ડિપોઝિટરી પાર્ટિસિપન્ટનો સંપર્ક કરી ઈ-મેઇલ સરનામું નોંધાવે. રિમોટ ઈ-વોટિંગ તથા AGM દરમિયાન ઈ-વોટિંગ કરવાની રીત:

કંપની તેના શેરહોલ્ડરોને AGMની નોટિસમાં દર્શાવેલ તમામ ઠરાવ પર મતદાન કરવા માટે રિમોટ ઈ-વોટિંગ સુવિધા (remote e-voting) પ્રદાન કરે છે. ઉપરાંત, કંપની AGM દરમિયાન પણ ઈ-વોટિંગ દ્વારા મતદાન કરવાની સુવિધા પ્રદાન કરે છે.

ઇલેક્ટ્રોનિક મોડ/ફિઝિકલ મોડમાં શેર ધરાવતા શેરહોલ્ડરો માટે રિમોટ ઈ-વોટિંગ તથા AGM દરમિયાન ઈ-વોટિંગની વિગતવાર પ્રક્રિયા AGM નો ટિસમાં આપવામાં આવશે.

AGM માટે ઈ-વોટિંગ સુવિધા માટે રેકોર્ડ તારીખ સોમવાર ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ નક્કી કરવામાં આવી છે. જો તમને CDSL ઈ-વોટિંગ સિસ્ટમમાંથી AGM અને ઈ-વોટિંગમાં હાજરી આપવા અંગે કોઈ પ્રશ્નો

અથવા સમસ્યાઓ હોય, તો તમે helpdesk.evoting@cdslindia.comપર ઇમેઇલ લખી શકો છો અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૧૦૯૯૧૧ પર સંપર્ક કરી શકો છો.

નિયમિક મંડળના આદેશ દ્વારા રચના ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એસ.ં^{ડી}./-**ગિરીશકુમાર ઓ. રાવલ** ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર (ડીન: ૦૧૬૪૬૭૪૭)

Ynuvama

સ્થળ: અમદાવાદ

તારીખઃ ૨૬ ઑગસ્ટ, ૨૦૨૫

NUVAMA WEALTH MANAGEMENT LIMITED

CIN: L67110MH1993PLC344634

Regd. Office - 801- 804, Wing A, Building No. 3, Inspire BKC, G Block, Bandra Kurla Complex, Bandra East, Mumbai - 400 051 Tel: (91-22) 6620 3030 E-mail: secretarial@nuvama.com Website: www.nuvama.com

NOTICE OF 32nd ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCING / OTHER AUDIO-VISUAL MEANS AND OTHER DETAILS THEREOF

Notice is hereby given that the 32nd Annual General Meeting ("AGM") of the Members of Nuvama Wealth Management Limited ("the Company") will be held on Wednesday, September 24, 2025, at 12:00 p.m. (IST), through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM") without physical presence of the Members at a common venue, to transact the business as set out in the Notice of the AGM ("AGM Notice") in compliance with the provisions of the Companies Act, 2013 ("the Act") and SEBI (Listing Obligations and Disclosure Requirements), Regulations 2015 ("Listing Regulations") read with General Circular No. 14/2020 dated April 8, 2020, General Circular No. 20/2020 dated May 5, 2020 and subsequent circulars issued in this regards, the latest being General Circular No. 9/2024 dated September 19, 2024, issued by the Ministry of Corporate Affairs ("MCA") and Circular no. SEBI/HO/CFD/CFDPoD-2/P/CIR/2024/133 dated October 3, 2024, and all the other applicable circulars issued by Securities and Exchange Board of India ("SEBI") in this regard (collectively referred as ("MCA and SEBI Circulars").

In compliance with the aforesaid MCA and SEBI Circulars, the AGM Notice along with the Annual Report for F.Y. 2024-25 ("Annual Report") will be sent only through electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/ Depositories/ Registrar and Transfer Agent ("RTA"), Further, in accordance with Regulation 36 (1)(b) of the Listing Regulations, a letter providing a weblink and QR code for accessing the AGM Notice and the Annual Report will be sent to those Members who have not registered their e-mail

The Members may note that the AGM Notice and Annual Report will also be available on the website of the Company i.e. www.nuvama.com and websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of MUFG Intime India Private Limited (Formerly known as Link Intime India Private Limited) ("MUFG Intime") at https://instavote.linkintime.co.in. However, the Members who wish to obtain hard copy of AGM Notice and the Annual Report can request the same by sending an e-mail to the Company at secretarial@nuvama.com.

Members can attend and participate in the AGM through the VC/OAVM facility only. The instructions for joining the AGM through VC/OAVM will be provided in the AGM Notice. Only the Members attending the AGM through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act.

The Company will be providing remote e-voting facility ('remote e-voting') to all its Members to cast their votes on all resolutions set out in the AGM Notice. Additionally, the Company is providing the facility of voting through e-voting system during the AGM ("e-voting"). Members who have not registered their e-mail address will have an opportunity to cast their vote on the resolutions as set out in the AGM Notice through remote e-voting and e-voting. Accordingly, a detailed procedure (a) for remote e-voting and e-voting and (b) for participating in the AGM through VC /OAVM, for Members holding shares in dematerialized / physical mode, will be provided in the AGM

Members who are holding shares in physical form or non-individual Members who acquire shares of the Company after AGM Notice has been sent electronically by the Company, may obtain the User ID and Password by sending a request at rnt.helpdesk@in.mpms.mufg.com. However, if a Member is already registered for remote e-voting, then they can use their existing User ID and Password for casting the vote.

Members are requested to register/update their e-mail address as well as intimate changes, if any, in their name, postal address, telephone/mobile number, bank account details, Permanent Account Number, Nominations etc. to their Depository Participants in case the shares are held by them in dematerialized form and in case the shares are held by them in physical form to MUFG Intime, RTA of the Company in prescribed Form ISR-1 and other prescribed forms.

Members are requested to carefully read all the notes set out in the AGM Notice and in particular, instructions for attending the AGM through VC/OAVM, manner for casting vote through remote e-voting/e-voting during AGM

The AGM Notice will be sent to the Members in accordance with the applicable laws to their registered e-mail address in due course.

For Nuvama Wealth Management Limited

sd/-Sneha Patwardhan Company Secretary & Compliance Officer ACS: 23266

Mumbai, August 25, 2025